



SHREE VASISHTHA VIDHYALAYA

Gujarati 2nd Language Worksheet 2025-26



Name : -

Std.:- IV -

Roll No. :-

Worksheet No. Term I-01

Date : -

પાઠ - ૩ સ્વામી વિવેકાનંદ, પાઠ -૪ નવરાત્રી, પાઠ-૬ એવરેસ્ટ સાથે મારી મુલાકાત, પાઠ-૭ મા ના ગુણો , પાઠ-૮ કબકી

ગદ્યાંશ

એક હતો છોકરો. તેનું નામ નરેશ હતું. નરેશ ભણવામાં હોશિયાર હતો. તે રોજ શાળાએ જતો અને ભણતો. એક દિવસ તે શાળાએથી ઘરે આવતો હતો ત્યારે તેણે રસ્તામાં એક ફૂતરું જોયું. ફૂતરું ખૂબ જ બીમાર લાગતું હતું. નરેશને તેના પર દયા આવી. તેણે ફૂતરાને ખાવાનું આપ્યું અને પાણી પણ પીવડાવ્યું. ધીમે ધીમે ફૂતરો સ્વસ્થ થવા લાગ્યો. નરેશ તેને રોજ ખાવાનું આપતો અને તેની સંભાળ રાખતો. ધીમે ધીમે ફૂતરું નરેશનો ખાસ મિત્ર બની ગયું.

પ્ર-૧) ઉપરના ગદ્યાંશ પરથી નીચેનાં પ્રશ્નોનાં જવાબ લખો.

૧) છોકરાનું નામ શું હતું?

૨) નરેશ ક્યાં જતો હતો?

૩) નરેશ રસ્તામાં શું જોયું?

૪) નરેશ ફૂતરાને શું આપ્યું?

પ્ર-૨) પાઠના આધારે ખાલી જગ્યા પૂરો.

(૧) બાળક જ્યારે પડી જાય ત્યારે માતા -----કહીને તેના ઓવરણાં લે છે.

(૨) કોઈ કબકી ટીમ પોતાના ખેલાડી ----- વાર બદલી શકે છે.

(૩) બાંગ્લાદેશનો રાષ્ટ્રીય ખેલ ----- છે.

(૪) કબકીની ટીમમાં ખેલાડી ----- હોય છે.

(૫) વિરોધી પાલામાં ગયેલ ખેલાડી નિરંતર ----- બોલતો હોય છે.

(૬) ----- ની બુદ્ધિ કુશાગ્ર હતી.

પ્ર-૩) યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો.

૧) કોણ આપણને ભીનામાંથી સૂકામાં સુવાડે છે?

(અ) માતા

(બ) પિતા

(ક) દાદી

(૨) કવિ દલપતરામ કોના સ્નેહની વાત કરી રહ્યા છે?

(અ) ભાઈ

(બ) બહેન

(ક) માતા



(૩) એવરેસ્ટની આ પૂરી યાત્રામાં બચેન્દ્રીને કેટલો સમય લાગ્યો?

(અ) ૧૦ કલાક અને ૪૦ મિનિટ (બ) ૧૦ કલાક અને ૫૦ મિનિટ (ક) ૧૬ કલાક અને ૪૦ મિનિટ

(૪) બચેન્દ્રી પાલના રેગ્યુલેટર પર ઓક્સિજનનું પ્રમાણ કોણે વધારે કર્યું?

(અ) અંગદોરજીએ (બ) લ્હાટ્સે (ક) કર્નલ ખુલ્લે

(૫) કબડીની પ્રત્યેક દળોમાં કેટલા અવેજી ખેલાડી હોય છે?

(અ) ત્રણ ત્રણ (બ) પાંચ પાંચ (ક) સાત સાત

(૬) કયો તહેવાર ભારતમાં અને વિદેશમાં પણ ઉજવવામાં આવે છે?

(અ) નવરાત્રી (બ) ૧૫મી ઓગસ્ટ (ક) ૨૬મી જાન્યુઆરી

પ્ર-૪) પાઠના આધારે નીચેનાં વાક્યો ખરા [✓] છે કે ખોટા [×] તે જણાવો.

(૧) કવિ માતાના પ્રેમને 'મહા હેતવાળી દયાળી મા' શબ્દથી પ્રયોજે છે. []

(૨) બચેન્દ્રી એવરેસ્ટની ટોચ પર સાત વાગીને એક મિનિટે પહોંચી. []

(૩) બચેન્દ્રી ૨૫ મે, ૧૯૮૪ના દિવસે એવરેસ્ટ પર પહોંચી. []

(૪) કોઈ ખેલાડીને ઈજા પહોંચે તો તેની જગ્યાએ અવેજી ખેલાડી રમે છે. []

(૫) માતા દુર્ગાએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું, જે નવ દિવસ ચાલ્યું. []

પ્ર-૫) પાઠના આધારે નીચેનાં પ્રશ્નોનાં એક વાક્યમાં જવાબ લખો.

૧) બરફ દૂર કરવા માટે બચેન્દ્રીએ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો?

૨) બચેન્દ્રીના દલનેતા કોણ હતા?

૩) એવરેસ્ટ પર પહોંચવાની સૂચના કોણે આપી?

૪) દાદાજી બાળપણમાં કયો ખેલ રમતા હતા?

૫) ભારતનો રાષ્ટ્રીય ખેલ કયો છે?

૬) કેટલા વજનથી વધારે વજનવાળી વ્યક્તિ કબડી રમી શકતી નથી?